



# પારિવારિક હિંસા અને પાર્ટનર વીઝા

## પાર્ટનર વીઝા પર હોય તેવા લોકોએ ઓસ્ટ્રેલિયામાં રહેવા માટે અત્યાચાર ભર્યા સંબંધો ટકાવવાની જરૂર નથી.

ઓસ્ટ્રેલિયામાં ઘરેલુ અને પારિવારિક હિંસાને સ્થાન નથી.

તમારો સ્ત્રી કે પુરુષ સાથી, કુટુંબના સભ્યો કે સમાજની અન્ય કોઈ પણ વ્યક્તિ તમારા વીઝાના દરજ્જાને જોખમમાં મૂકી શકે નહીં.

જો તમે ટેમ્પરરી પાર્ટનર વીઝા (સબ ક્લાસ 309 કે 820) અથવા પ્રોસ્પેક્ટીવ મેરેજ વિઝા (સબ ક્લાસ 300) પર હોવ અને પારિવારિક હિંસાનો અનુભવ કરો અને તેના થકી તમારાં સંબંધો તૂટી ગયા હોય તો પણ તમારી પરમેનન્ટ પાર્ટનર વીઝા (સબ ક્લાસ 100 કે 801)ની અરજી ચાલુ રાખવાની વ્યવસ્થા ઓસ્ટ્રેલિયાના માઇગ્રેશન કાયદાઓમાં છે.

જો તમે કે તમારી ઓળખીતી વ્યક્તિ જોખમમાં હોવ તો **000** પર પોલીસને ફોન કરો.

ઓસ્ટ્રેલિયામાં પોલીસ પાસે જવું સલામત છે અને તેમનાં પર વિશ્વાસ કરી શકાય છે.

મફત અને ખાનગી સલાહ (counselling) અને માહિતી માટે 1800RESPECT ને **1800 737 732** પર ફોન કરો.

જો તમારે મફત દુભાષિયા સેવાની જરૂર હોય તો **131 450** પર ફોન કરો.

## ઓસ્ટ્રેલિયાની સરકાર (Australian Government) કોઈપણ સંજોગોમાં ઘરેલુ અને પારિવારિક હિંસા યલાવી લેતી નથી.

ઘરેલુ અને પારિવારિક હિંસા આચરવી એ કાનૂની ગુનો છે. આવો ગુનો કરનાર વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ, તેને જેલની સજા થઈ શકે છે.

ઘરેલુ અને પારિવારિક હિંસા, એ સાથીમાં સલામતી કે સુખાકારી અંગે ભય ઉત્પન્ન કરીને તેમને કાબૂમાં રાખવાના હેતુથી કરવામાં આવતું વર્તન કે આપવામાં આવતી ધમકીઓ છે.

## ઓસ્ટ્રેલિયામાં ઘરેલુ કે પારિવારિક હિંસાનો ભોગ બનનાર કોઈપણ વ્યક્તિ સર્વિસીસ (સહાય સેવાઓ)ની મદદ મેળવી શકે છે.

તમે વીઝા પર હોવ કે દેશાગમન (ઇમિગ્રેશન)નાં ગમે તે તબક્કામાં હોવ તો પણ તમે મદદ મેળવી શકો છો.

તમારાં સંબંધો તૂટી ગયાં હોય કે હજુ ચાલુ હોય તો પણ ફરક પડતો નથી-તમે હજુ પણ મદદ મેળવી શકો છો.

**1800RESPECT** એ જાતીય સતામણી, ઘરેલુ અને પારિવારિક હિંસાનો ભોગ બનેલાઓને સલાહ આપતી ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય સ્તરની સેવા છે (Australia's national sexual assault, family and domestic violence counselling service). તે મફત અને ખાનગી સલાહ અને માહિતી, ફોન પર કે ઓનલાઇન આપી શકે છે. સલાહ આપનારાઓ તમારી વાતો સાંભળે, તમારા પ્રશ્નોના જવાબ આપી શકે અને તમારી નજીકના વિસ્તારમાં ઉપલબ્ધ બીજી મદદ કરતી સેવાઓ તરફ તમને દોરી શકે છે.

**1800 737 732** પર ફોન કરો અથવા **1800RESPECT** ની વેબસાઇટ [www.1800RESPECT.org.au](http://www.1800RESPECT.org.au) પર જાઓ.

## શું તમારે દુભાષિયાની જરૂર છે?

131 450 પર ભાષાંતર અને દુભાષિયા સેવા (**Translating and Interpreting Service**) (ટીસ) માટે ફોન કરો. ટીસમાંથી દુભાષિયો તમને બીજી સેવાઓ સાથે વાતચીત કરવામાં મદદ કરશે, જોકે ટીસ દ્વારા સલાહ (counselling) આપવામાં આવતી નથી. બધા કોલ્સ મફત અને ખાનગી હોય છે.

## જો તમે વિઝા ધરાવતા હો, તો પારિવારિક હિંસા વિશે વધુ માહિતી માટે:

પારિવારિક હિંસા અને વિઝા વિશેની વધુ માહિતી ગૃહ ખાતા (**Department of Home Affairs**) ની વેબસાઇટ [www.homeaffairs.gov.au](http://www.homeaffairs.gov.au) પર છે.